

Dr. Babasaheb Ambedkar Open University

Term End Examination January – 2026

Course : M.Com. Sem-03

Subject Code : MC03EC302

Subject Name : નાણાકીય પત્રકોનું વિશ્લેષણ
(Financial Statements Analysis)

Date : 02/03/2026

Time : 11:30am to 01:45pm

Duration : 02.15 Hours

Max. Marks : 70

પ્રશ્ન-1 નાણાકીય પત્રકોનો અર્થ આપી તેનું સ્વરૂપ અને પ્રકારો સમજાવો.

14

અથવા

તુલનાત્મક પાકું સરવૈયું નો નમુનો કાલ્પનિક આંકડાઓ સાથે તૈયાર કરો.

પ્રશ્ન-2 દેવ લિ. નું પાકું સરવૈયું (તા. 31/3/2021 ના રોજનું)

14

વિગત	નોંધ નં.	રકમ (₹)
I. ઈક્વિટી અને દેવાં :		
1. શેરહોલ્ડરોનાં ભંડોળો:		
(A) શેરમૂડી		5,00,000
(B) અનામતો અને વધારો		5,00,000
2. લાંબાગાળાના દેવા:		
9% ના ડિબેન્યર		5,00,000
3. ચાલુ દેવા:		
(A) લેણદારો		3,00,000
(B) ટૂંકાગાળાની કરવેરાની જોગવાઈ		50,000
કુલ		18,50,000
II. મિલકતો :		
1. કાયમી મિલકતો:		
જમીન – મકાન		2,50,000
પ્લાન્ટ - ચંત્રો		9,00,000
2. ચાલુ મિલકતો:		
સ્ટોક		3,25,000
દેવાદારો		2,00,000
રોકડ સિલક		1,75,000
કુલ		18,50,000

વધારાની માહિતી:

- વેચાણ: ₹ 14,60,000
- કાયો નફો: ₹ 2,60,000
- ચોખ્ખો નફો (વ્યાજ અને કરવેરા પહેલાનો): ₹ 1,50,000
- તા. 1/4/2020 (શરૂનો સ્ટોક): ₹ 2,25,000

ઉપરની માહિતી પરથી નીચેના ગુણોત્તરોની ગણતરી કરો:

1. ચાલુ ગુણોત્તર
2. માલ-ફેરબદલી (સ્ટોક) ગુણોત્તર
3. દેવાદાર ગુણોત્તર
4. રોકેલી મૂડી પર વળતર

અથવા

રોકાયેલી મૂડી પર વળતર દર નો અર્થ આપી તેનું મહત્વ સવિસ્તાર ચર્ચો.

પ્રશ્ન-3 ફેરબદલી કિંમત નિર્ધારણનો અર્થ આપી તેની પદ્ધતિઓ વિગતે સમજાવો.

14

અથવા

મુલ્યવૃદ્ધિ નો અર્થ આપી તેના પ્રાપ્તિસ્થાનો અને ઉપયોગો સમજાવો.

પ્રશ્ન-4 બેલેન્સ સ્કોર કાર્ડ નો અર્થ આપી તેના લક્ષણો અને ઉદ્દેશો સમજાવો.

14

અથવા

વિભાગીય વિશ્લેષણની પદ્ધતિ સવિસ્તાર સમજાવો.

પ્રશ્ન-5 (A) ટૂંકનોંધ લખો. (ગમે તે ત્રણ)

09

1. નાણાકીય અહેવાલ પ્રેષણના ઉપયોગો
2. રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક વચ્ચે તફાવત
3. ગુણોત્તર વિશ્લેષણ નું મહત્વ
4. ડ્યુ પોન્ટ ચાર્ટ
5. બેલેન્સ સ્કોર કાર્ડની મર્યાદાઓ સમજાવો

(B) નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો

05

1. નાણાકીય પત્રકનાં વિશ્લેષણમાં વિવિધ નો ઉપયોગ થાય છે.
(A) તકનીકો (B) માધ્યમો (C) નિયમો (D) સિદ્ધાંતો
2. નાણાકીય અહેવાલના મુખ્ય ઘટકો છે.
(A) આવકપત્ર (B) સરવૈયા (C) રોકડ પ્રવાહ (D) ઉપરના બધા
3. આદર્શ ચાલુ ગુણોત્તર છે.
(A) 2:1 (B) 1:1 (C) 3:1 (D) 1:2
4. નીચેનામાંથી કઈ અવાસ્તવિક મિલકત નથી?
(A) બાંયધરી કમિશન (B) ડિબેન્ચર વટાવ (C) પ્રાથમિક ખર્ચા (D) પાઘડી
5. સમાનતા દર્શાવતું વલણ સામાન્ય રીતે _____ પ્રમાણે બનાવાય છે.
(A) ગુણોત્તર (B) ટકાવારી (C) બંને (D) એકપણ નહીં
